શુભ-સંદેશ



શાસ્ત્રી **પુરુષોત્તમચરણ** દાસજી
શ્રી સ્વામિનારાયણ સંસ્થા ધામ
(ગુરૂકુળ) મું. ઝુંડાલ તા. જી.
ગાંધીનગર

સમયની વહેતી ધારામાં વહેણ હંમેશા બદલાતા રહે છે તેમાં ક્યારેક ચઢાવ ક્યારેક ઉતાર અને ક્યારેક વમળો પણ સર્જાય છે તેનો ભોગ સમગ્ર માનવ સમાજ બનતો રહ્યો છે તે ભાગવત ધર્મ ગ્રંથોમાં અને ઇતિહાસમાં સહેજે જોઈ શકાય છે આવી વિરલ ઘટનાઓની બાબતમાં હિન્દુ ધર્મમાં યુગ-યુગાંતરો અને મન્વન્તરોમાં શ્રી દશાવતારોની ઘટનાઓ અને ચરિત્રો સાક્ષીભૂત છે અને આ ઘટનાઓ વિશ્વમાં અદ્‌ભુત છે. જે તે અવતારોના ચરિત્રથી આપણે વિશ્વમાં ગર્વ અને ગૌરવ સાથે ઉન્નત મસ્તક કરી શકીએ તેમ છીએ. વિશ્વમાં હિંદુ સમાજ સૌથી ઉંચેરો અને અદ્‌ભુત રચનાત્મક સમાજ છે !!!

[illegible] ગૌરવવંતી ઘટનાઓના એક ભાગરૂપે ભરતખંડમાં આપ. શ્રી અત્યંત ભાગ્યશાળી છો. કારણ કે જે દસમો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણનો થવાનો છે જેના આગમન પૂર્વે જ આપે કેવા સરસ મજાના નિયમોને આચરણમાં મૂકેલ છે આપના

શુભ-સંદેશ



શાસ્ત્રી પુરુષોત્તમચરણ દાસજી
શ્રી સ્વામિનારાયણ સંસ્થા ધામ
(ગુરૂકુળ) મું. ઝુંડાલ તા. જી.
ગાંધીનગર

સમયની વહેતી ધારામાં વહેણ હંમેશા બદલાતા રહે છે તેમાં ક્યારેક ચઢાવ ક્યારેક ઉતાર અને ક્યારેક વમળો પણ સર્જાય છે તેનો ભોગ સમગ્ર માનવ સમાજ બનતો રહ્યો છે તે ભાગવત ધર્મ ગ્રંથોમાં અને ઈતિહાસમાં સહેજે જોઈ શકાય છે આવી વિરલ ઘટનાઓની બાબતમાં હિન્દુ ધર્મમાં યુગ-યુગાંતરો અને મન્વન્તરોમાં શ્રી દશાવતારોની ઘટનાઓ અને ચરિત્રો સાક્ષીભૂત છે અને આ ઘટનાઓ વિશ્વમાં અદ્‌ભુત છે. જે તે અવતારોની ચરિત્રથી આપણે વિશ્વમાં ગર્વ અને ગૌરવ સાથે ઉન્નત મસ્તક કરી શકીએ તેમ છીએ. વિશ્વમાં હિંદુ સમાજ સૌથી ઉંચેરો અને અદ્‌ભુત રચનાત્મક સમાજ છે !!!

કુશિત ગૌરવવંતી ઘટનાઓના એક ભાગરૂપે ભરતખંડમાં આપ શ્રી અત્યંત ભાગ્યશાળી છો. કારણ કે જે દસમો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ થવાનો છે જેના આગમન પૂર્વે જ આપે કેવા સરસ મજાના નિયમોને આચરણમાં મૂકેલ છે આપના

(સતપંથ)ના સત્સંગી બંધુઓના (૧) શરીર શુદ્ધિ (૨) હૃદય શુદ્ધિ (૩) વ્રત (૪) ઉપાસના (૫) પ્રતિજ્ઞા જેવા પાંચ ઉદાત નિયમોનું પાલન એ સમગ્ર હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે અને એથી વિશેષ આનંદની વાત તો એ છે કે હજુ તો ભગવાન અવતરવાના છે, મહેમાન આવતા પૂર્વેની આપની તૈયારી ખૂબ જ સૂચક છે. માટે હે સતપંથી બંધુઓ આપને જે શ્રીઈમામશાહ મહારાજે માર્ગ બતાવ્યો છે તેમાં તેના અર્થ અનર્થમાં સમય બગાડવા કરતા આપણે સૌ ઈમામશાહ મહારાજને સમજવાની કોશીશ કરીએ... શું ઈમામશાહ મહારાજ ખરેખર મુસ્લિમ હતા? તો હું ચોક્કસ કહીશ કે ના ઈમામશાહ મહારાજ એક પવિત્ર બ્રાહ્મણ ખોળીએ જન્મેલા શુદ્ધ હિન્દુ જ હતાં પરંતુ સમયના વહેણ અને વમળોને જોઈ વિચારી તેમણે માત્ર ને માત્ર હિન્દુ ધર્મની રક્ષા કાજે પોતાની જાતનો ભોગ આપીને હિન્દુ ધર્મને બચાવવાનું કાર્ય ચાણક્ય બુદ્ધિ પૂર્વક કર્યું છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજના લખેલા- ધર્મ ગ્રંથોનાં અને તેમના ચરિત્રોનાં આધારે સ્પષ્ટ દેખાય છે કે તેઓ હિન્દુ કુખે જ જન્મેલા છે તેમાં કોઈએ પણ શંકા કરવાની જરૂર રહેતી નથી માટે હે! સતપંથી બંધુઓ મારા માનવા પ્રમાણે શ્રી ઈમામશાહ મહારાજના મુળ આદર્શોને યથા યોગ્ય રીતે મુર્ત સ્વરૂપ આપવા માટેજ આચાર્ય પદે પુજ્ય પાદ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજને મોકલ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે પરમ પૂજ્ય આચાર્યશ્રી કરસનદાસજી મહરાજને ગાદી ઉપર આવ્યા પછી ફક્ત દશ વર્ષનાં ટૂંકા ગાળામાં આકાશમાં ચમકતા નવ લાખ તારા સમાન આ ધરતી ઉપર રહેલા શ્રી ઈમામશાહ મહારાજના નવ લાખ અનુયાયીઓને ઈમામશાહ મહારાજની ઈચ્છા મુજબની શુદ્ધ ઉપાસના માટે જ બિન જરૂરી બંધનમાંથી મુક્તિ અપાવી છે જે એક મહાન

ક્રાંતિકારી ને આજે તેનાથી પણ વિશેષ ક્રાંતિકારી કાર્ય સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજની ઇચ્છાથી પાર પડ્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને તેથી જ આચાર્ય શ્રી કરશનદાસજી મહારાજ માટે ફરી - ફરી ને કહીશ કે શ્રી કરસનદાસજી મહારાજ તે માત્ર શ્રી કરસનદાસજી મહારાજ જ નહી પરંતુ તેઓ શ્રી વિરવર ઉપાધીથી વિભૂષિત વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ કહેવાનું સહેજે મન થઈ આવે છે તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી જ માટે હે! સતપંથી બંધુઓ આપને આવા ઉત્તમ અને શુરવિર સદ્‌ગુરુ (આચાર્યશ્રી) મળ્યા છે તો તેમના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ખંભે-ખભા મિલાવીને સતપંથ સંપ્રદાયના વિકાસ અને વિસ્તાર માટે કામે લાગી જઈએ એજ આજના સમયની માંગ છે.

આપ સૌ સંસારમાં રહો છો એટલે આપને કહેવાની જરૂર નજ હોય છતા મારી સમજણ પ્રમાણે એટલું ચોક્કસ કહીશ કે આજના યુગમાં સંસ્કાર અને ધર્મની તાતી જરૂર છે જેમાં આપનું - આપણું અને સર્વનું શ્રેય છે. સંસ્કાર અને ધર્મના સિંચન માટે જેમ સંસ્કાર શિબિરોનો અને મંદિરોના નવ નિર્માણનો પ્રયાસ આપે જારી રાખેલ છે તેમાં એક શિક્ષણ સંકૂલ (ગુરુકૂલ)નો ઉમેરો થશે તો આવનારી પેઢીઓ યુગો - યુગો સુધી આપના આ પુરુષાર્થને ભુલશે નહીં તેમ મારુ માનવું છે તો આઈએ શ્રી ઇમામશાહ મહારાજના ઉપદેશ અનુસાર અંધશ્રદ્ધા છેડીને જ્ઞાન ભક્તિ વૈરાગમાં જોડાવું!!! સતપંથના સંસ્થાપકની ઇચ્છાને માન આપી મોક્ષમાર્ગી બનવાનો પ્રયત્ન કરી સફળતા પ્રાપ્ત કરીએ એજ પ્રભુ પાસે પ્રાર્થના...!!! ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમઃ!!